

ત્વરિત જાહેરાત માટે

## સીટી ઓફ બ્રેમ્પટને COVID-19 નો ફેલાવો રોકવા બધાં પાર્ક્સ બંધ કર્યા

બ્રેમ્પટન, ઓન્ટેરિયો (માર્ચ 26, 2020) – તાત્કાલિક અમલમાં આવે તે રીતે, આગળ સૂચના આપવામાં આવે ત્યાં સુધી, બ્રેમ્પટનમાં બધાં 500+ પાર્ક્સ જાહેર જનતા માટે બંધ કરવામાં આવ્યા છે, જેથી COVID-19 નો ફેલાવો રોકવામાં મદદ મળી શકે.

આમાં સામેલ છે:

- પ્લે ગ્રાઉન્ડ્સ (રમતના મેદાનો)
- લીશ-ફી ડોગ પાર્ક્સ
- તમામ આઉટડોર સ્પોર્ટ્સ સગવડો અને આઉટડોર ફિટનેસ ઈક્વિપમેન્ટ્સ
- પિકનિક શેલ્ટર્સ (ઉજાણી સ્થાનો)

પાર્ક ક્લોઝર્સ દર્શાવતા સાઈન બોર્ડ્સ સીટી પાર્ક્સમાં આ અઠવાડિયે ફિટ કરવામાં આવશે.

આ ક્લોઝર્સ પીલ પબ્લિક હેલ્થના ફિઝિકલ ડિસ્ટન્સિંગ (બે વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર) જાળવવાના અને લોકોને જાહેર સ્થળોએ એકઠા થતા રોકવા સંબંધિત માર્ગદર્શનને અનુરૂપ છે.

રહેવાસીઓએ કોઈ વિવાદ નોંધાવવા સીટીની સિક્યુરિટી સર્વિસીસનો સંપર્ક 905.874.2111 નંબર પર કરવો જોઈએ.

COVID-19 ની પરિસ્થિતિ દરમિયાન સીટી ઓફ બ્રેમ્પટન શું કરી રહ્યું છે તે સંબંધિત અદ્યતન માહિતી મેળવવા વેબસાઈટ જુઓ, [www.brampton.ca/COVID19](http://www.brampton.ca/COVID19).

### અવતરણો (ક્વોટ્સ):

“સીટી ઓફ બ્રેમ્પટનમાં, અમારી અગ્રતા હંમેશા અમારા રહેવાસીઓનું આરોગ્ય અને સુરક્ષાની રહે છે. અમે COVID-19 વધુ ફેલાવો થતો રોકવામાં મદદ મેળવવા અમારાથી શક્ય બધું કરવા કટિબદ્ધ છીએ. અમે રહેવાસીઓને ફિઝિકલ ડિસ્ટન્સિંગ (બે વ્યક્તિઓ વચ્ચે શારીરિક અંતર) જાળવવા આજીજી કરીએ છીએ, અને રોગચાળો ફેલાવાના પ્રવર્તમાન વલણને પલટાવવાના હેતુસર, અમારે યથાર્થ સંદેશો પહોંચાડવાના હેતુસર વધારે યુસ્ત પગલાઓ લેવાની જરૂર પડી છે. એ વાત તદ્દન નિર્ણાયક બની રહે છે કે રહેવાસીઓ આ પરિસ્થિતિ અને ફિઝિકલ ડિસ્ટન્સિંગ અને આ સમયે ઘરે રહેવાનું મહત્વ સમજે.”

- પેટ્રિક બ્રાઉન (Patrick Brown), મેયર, સીટી ઓફ બ્રેમ્પટન

“બ્રેમ્પટનના બધાં પાર્ક્સ બંધ કરવાની આજની ઘોષણા અમારા રહેવાસીઓ અને કર્મચારીગણને આ સમયે સુરક્ષિત રાખવાની અમારી કટિબદ્ધતાનો દૃઢનિશ્ચય દર્શાવે છે. COVID-19 વૈશ્વિક સ્તરે બહુ ઝડપથી ફેલાઈ રહેલો રોગચાળો છે, અને અમે પરિસ્થિતિ પર દેખરેખ રાખી રહ્યાં છીએ અને તે મુજબ પગલાઓ ભરવાનું ચાલુ છે.”

- ડેવિડ બારિક (David Barrick), ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર, સીટી ઓફ બ્રેમ્પટન

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રેમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો [www.brampton.ca](http://www.brampton.ca).

**મિડિયા સંપર્ક:**

મોનિકા ડુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રેમ્પટન

905-874-3426 | [Monika.Duggal@brampton.ca](mailto:Monika.Duggal@brampton.ca)